

જનસંપર્ક અધીકારી દ્વારા  
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર  
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩  
કંટ્રોલરૂમ ટેલીફોન નંબર ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૨૮/૧૨/૨૦૧૬ બુધવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

અમદાવાદ શહેર પોલીસ તરફથી કરવામાં

આવેલ પ્રશંસનીય/નોંધપાત્ર કામગીરી:-

સમાચાર યાદી નં.૨૩૯૩/૧૬

### ઝોન-૨ સ્ટ્રાઇકીંગ ફોર્સ

અ.હે.ડ કોન્સ સૈયદ અહેમદ સિરાજ અહેમદ બ.નં.૮૧૩૩ નોકરી : ઝોન-૨ સ્ટ્રાઇકીંગ ફોર્સ , નાઓ આજરોજ યાંદખેડા ખાતે આવતાં ક ૧૯/૪૫ વાગે સાથેના હે.કો જગાભાઇ છનાભાઇ બ.નં.૯૪૭૩ નાઓને બાતમી હકીકત મળેલ કે, યાંદખેડા શારદા પેટ્રોલપંપની લાઇનમાં આવેલ શિવશક્તિ બસ સ્ટેન્ડ પાસે બે ચાલીસ થી પચાસના આશરના ઇસમો મેસ્ટ્રો સ્કુટર પર આવનાર છે અને જેઓ પોતાની પાસે રાખેલ ગેરકાયદેસર ૨૦૦૦/- ના દરની નવી ચલણી નોટો આપી કમીશન લઇ જુની નોટો એક્સચેન્જ કરવા આવનાર છે જે બાતમી આધારે સદરી ઇસમોની વોચમાં રહી થોડી વાર શિવ શક્તિ બસ સ્ટેન્ડ ખાતે ઉભા રહેલ ,થોડી વારે ઉપરોક્ત વર્ણનવાળા ઇસમો મેસ્ટ્રો સ્કુટર લઇ આવી શિવશક્તિ બસ સ્ટેન્ડ પાસે ઉભા રહેતા તેમની હિલચાલ શંકાસ્પદ જણાતાં પંચો સાથે તેમની સાથે જઇ તેઓ બન્નેના નામ ઠામ પુછતાં પ્રથમ ઇસમે પોતાનુ નામ રાજ સ/ઓ રામપાલ મહેશ્વરી ઉ.વ.૫૨ રહે: શ્રીજી એપાર્ટમેન્ટ,પોલીસ કમિશ્નર કચેરી સામે,શાહીબાગ,અમદાવાદ શહેર તથા બીજા ઇસમે પોતાનુ નામ સંજય કિશનલાલ સુરી ઉ.વ.૫૦ રહે: ૯૬, અંકુર ફ્લેટ,પાલડી,અમદાવાદ શહેર ના હોવાનુ જણાવેલ જેમની પંચો રૂબરૂ અંગજડતી કરતાં કોઇ ગુનાહીત ચીજ વસ્તુ જણાઇ આવેલ નહી તેમજ સદરી ઇસમોના કબજાના મેસ્ટ્રોની ડેકી ખોલાવી જોતા ડેકીમાંથી એક બ્લેક કલરનો થેલો મળી આવેલ અને જેમા એક બ્લ્યુ કલરની સફેદ ડિઝાઇન વાળી થેલીમા ૨૦૦૦/- ના દરની નવી ચલણી નોટો નંગ ૭૫૦/- જે કિ.રૂ.૧૫,૦૦,૦૦૦/- મળી આવેલ જેના સિરીયલ નંબરો અલગ હતાં.જે સબંધે પુછતાં કોઇ સંતોષકારક જવાબ આપતાં ન હોય તેમની પાસેથી મળી આવેલ ૧૫,૦૦,૦૦૦/- રૂપીયા તથા મેસ્ટ્રો સ્કુટર જી.જે.૧.પી.એ.૪૬૨૬ તથા નોકીયા કંપનીનો મોબાઇલ ફોન મળી આવેલ જે પંચનામા વિગતે કબજે લઇ બન્ને ઇસમોને સી.આર.પી.સી ૪૧(૧)(ડી) મુજબ અટક કરી વધુ તપાસ હાથ ધરી છે.

### યાંદખેડા પોલીસ સ્ટેશન :-

પો.સબ.ઈન્સ. એચ.બી.ચાવડા નાઓ આજ રોજ સ્ટાફના માણસો સાથે યાંદખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં દરમ્યાન ફરતા ફરતા કલાક ૨૦/૦૦ વાગે બાતમી હકીકત મળેલ કે યાંદખેડા વિસત સર્કલ પાસે આવેલ શુકન મોલમાં કેટલાક ઇસમો બહારથી આવી નવા ચલણની નોટો લઈ આવે છે અને જુની નોટો પચ્ચીસ ટકા કમિશનથી લઈ જાય છે જે બાતમી આધારે સદરી ઇસમોની વોચમાં રહીથોડી વારે એક ઇસમ વિસત ત્રણ રસ્તા તરફથી આવતો જણાવેલ જેણે બ્લ્યુ કલરનુ આખી બાંચનુ ટિ-શર્ટ તથા જીન્સ પેન્ટ પહેરેલ હોય જે આમ તેમ ફાંફા મારતો હોય જેના હાથમાં એક લાલ કલરનુ ઝૂભલુ (થેલી) જણાવેલ અને ધીરે ધીરે શુકન મોલ આગળ આવેલ જેની હિલચાલ શંકા સ્પદ જણાતા મોલના ખુણા ઉપર જતા તેને કોર્ડન કરી નામ-ઠામ પુછતા પોતે પોતાનુ નામ સિધ્ધાર્થ કમલેશભાઈ ચુડાસમા ઉ.વ. ૨૨, રહેવાસી. કે/૪/૩૮, શિવ શક્તિ એપાર્ટમેન્ટ, અખબારનગર, નવા વાડજ,

અમદાવાદ ના હોવાનું જણાવેલ જેની અંગ જડતી તપાસ કરતા તેની પાસેનું પ્લાસ્ટિકનું ઝભલું લઈ જોતા અંદર ચલણી નોટો નવી રૂપિયા ૨,૦૦૦/- ના દરની કુલ્લે પાંચ બંડલ જેમાં ચાર બંડલમાં ૨,૦૦૦/- ના દરની ૧૦૦/- લેખે રૂપિયા ૨,૦૦,૦૦૦/- લેખે ચાર બંડલની કુલ્લે કિ.રૂ. ૮,૦૦,૦૦૦/- તથા એક બંડલમાં ૨,૦૦૦/- ના દરની ૬૨ નોટો જે કુલ્લે રૂપિયા ૧,૨૪,૦૦૦/- જે તમામ ૨,૦૦૦/- ના દરની જુદા જુદા નંબરની કુલ્લે રૂપિયા ૯,૨૪,૦૦૦/- તથા સદરીના પેન્ટના ખિસ્સામાંથી એક સફેદ સિલ્વર કલરનો સિંગલ સિમનો ગુગલ પિક્સલ કંપનીનો મોબાઈલ ફોન જે પકડાયેલ ઈસમને સદરી ચલણી નોટો રૂપિયા ૯,૨૪,૦૦૦/- લઈ આવવા બાબતે પુછ-પરછ કરતા કોઈ સંતોષ કારક જવાબ આપતો ન હોય તેમજ ગલ્લા તલ્લા કરતો હોય સદરી નાણાં રૂપિયા ૯,૨૪,૦૦૦/- તથા ગુગલ પિક્સલ કંપનીનો મોબાઈલ કિ.રૂ. ૨૫,૦૦૦/- જે કુલ્લે રૂપિયા ૯,૪૯,૦૦૦/- નો મુદ્દામાલ પંચનામા વિગતે કબજે લઈ સદરી ઈસમને સી.આર.પી.સી. કલમ. ૪૧(૧)(ડી) મુજબ અટક કરી વધુ તપાસ હાથ ધરી છે.

## રીક્ષા માં નજર ચુકવી ચોરી કરતી ગેંગ ના આરોપીને

### પકડી ૧૦૦% મુદ્દામાલ રીકવર કરતી

### રામોલ પોલીસ અમદાવાદ શહેર

નાયબ પોલીસ કમિશ્નર શ્રી ડો. ગીરીશભાઈ પંડ્યા સાહેબ તથા મદદનિશ પોલીસ કમિશ્નર શ્રી નંદાસણા સાહેબ તથા સિનીયર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પી.આઇ.સોલંકી સાહેબ નાઓ તરફ થી મળેલ સુચના આધારે તા. ૨૭/૧૨/૧૬ ના રોજ સર્વેલન્સ સ્કોડ ના પો.સ.ઇ પી.ડી.સોલંકી સાહેબ સ્ટાફ ના માણસો સાથે મિલકત સબંધી ચોરીના ગુનાઓ શોધી કાઢવા સારૂ પેટ્રોલીંગમાં હતા અને ફરતા-ફરતા કલાક ૨૦/૦૦ વાગે વંડર પોઇન્ટ ચાર રસ્તા પાસે આવતા તેઓને મળેલ ખાનગી બાતમી હકીકત આધારે

(૧) રાજેશ @ પખ્તુ રમેશભાઈ સિસોદીયા ઉ.વ. ૩૩ રહે મન-૧૧, બળદેવ રો હાઉસ ઇન્દ્રજીત, સોસા. પાછળ સરદાર મોલની સામે કુખ્નગર અવાદ શહેર

(૨) સતીષ @ ભાઉ નરસિંગ કનગીરી(મરાઠી) ઉવ ૩૫ રહે મન સી/૧૦ રીના શોપીંગ સેન્ટર ઉપર કેનાલ પાસે પાશ્વનાથ ટાઉનશીપ નવા નરોડા અમદાવાદ શહેર

(૩) ઇરફાન ચાંદભાઈ મનસુરી ઉવ ૩૦ રહે ૩૨૭. મદની નગર જનતનગર પાસે રામોલ રોડ અવાદ શહેર

(૪) અયુબભાઈ અબ્દુલભાઈ મનસુરી ઉવ ૩૫ રહે. ૨૦૭ મદની જનતનગર પાસે રામોલ રોડ અવાદ શહેર

રામોલ પો.સ્ટેશન ફસ્ટ ગુ.ર.નં.૨૨૬/૧૬ ઇપીકો કલમ ૩૭૯, ૧૧૪ મુજબ ના ગુના નો ભેદ

ઉકેલી ગુના ના કામે ચોરાયેલ મુદ્દામાલ રોકડા રૂપિયા જુની ચલણી નોટો ૧,૦૦,૦૦૦/- તથા ઓટોરીક્ષા નં. જી.જે.૦૧ બી.ઝેડ.૭૫૧૮ ની કિ.રૂ ૫૫,૦૦૦/- ગણીચારેય આરોપીઓને ઉપરોક્ત ગુનાના કામે તા.૨૭/૧૨/૧૬ ના કલાક ૨૧/૦૦ વાગે પકડી અટક કરી વધુ પુછપરછ હાથ ધરેલ છે.

નાયબ પોલીસ કમિશ્નર,  
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.  
પોલીસ કમિશ્નર વતી.